

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૦/૦૭/૨૦૧૭ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૪૧૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૬ કેસ કરી ૨૬ વ્યક્તિઓને ઝડપી, ૪૭ લીટર દેશી દારૂ, ૨૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪ બિયર ટીન અને ૨ સ્ફૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૧૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૦,૭૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૧૩/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૪૧૪/૧૭

વાડજ: મીનાબહેન વા/ઓફ મદનલાલ સાખલા (ઉ.વ.૫૪) (રહે.કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ-૨ ગ્રીન પાર્કની બાજુમાં સોલા રોડ ઘાટલોડીયા) તા.૯/૭/૧૭ રાતના ૮/૧૫ વાગ્યાના સુમારે શિવમ એપાર્ટમેન્ટ ગેટ નંબર-૨ નજીકથી પતિ સાથે સ્કુટી પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ મીનાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ મીનાબહેન સાખલાએ વાડજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.બી.બુબડીયા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૪૧૫/૧૭

રીવરફ્રન્ટ વેસ્ટ: રવિ ભરતભાઈ ઠાકોર (ઉ.વ.૨૦) (રહે.ઝરીવાલાની ચાલી બળીયા લીમડી ચાર રસ્તા અસારવા) એ અગમ્ય કારણસર તા.૯/૭/૧૭ કલાક ૯/૪૦ વાગ્યા પહેલા સાબરમતી પશ્ચીમ કિનારે ઘાટ નંબર-૧૩ નજીક નદીમાં ડુબી જઈ આત્મહત્યા કરી હતી આ અંગે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હસમુખભાઈમગનભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર: ચંચળબહેન વા/ઓફ પુનાભાઈ પરમાર (રહે. કર્ણાવતીનગર બાપા સીતારામ ચોક નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૮/૭/૧૭ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈઆત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી જયપાલસિંહ વિજયસિંહ ચલાવે છે.

કાગડાપીઠ: પ્રવિણભાઈ ટાભાભાઈ જાદવ (ઉ.વ. ૫૪) (રહે. જનતાનગર હાઉસીંગ સોસાયટી ગીતામંદિર મજુર ગામ) ને કામ-મજુરી નહી થતા મનમાં લાગી આવતા તા.૮/૭/૧૭ કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લીધું હતું. સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડૉક્ટરીએ મૃત જાહેર કર્યા હતા આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ. શ્રી બાલાજી હિરાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.